

પ્રથમ શ્લોક

છાયે હમે જર્થોસ્તી, રે મસ્તદયસ્ની નેક,
કુલ જહાં સાથ દોસ્તી, રાખીએ નીભાવી ટેક,
મુતીજ ભાર આ તોલો, સૌવ એવામો શંગર,
રે બોલે બાવા બોલો, તેણી સોવ નર ને નાર,
કોરસ:

ઓ તોખુમ ક્યાની, ઓ જગમશૂર,
ઓ સવ સદગુમ્મા સાચી ને ભરપુર,
કાયમ રહી જાલાવજે, શુભ મોજ જોમ,
અબડી સાતે જીવજો પારસી કોમ,
બીજો શ્લોક

બહોલી સકાવત હેતે, જે ચે જગત જાહર,
બહુ યાંયાલાઇ સાથ, સવ વત મે મહેર,
ગુજરી જાફાઓ ભારી, તો પું ના છોધો ધરમ,
તેહી માલી રૂબ્યારી, આજ ખરો છો ભારમ,
કોરસ:

ઓ તોખુમ ક્યાની, ઓ જગમશૂર,
ઓ સવ સદગુમ્મા સાચી ને ભરપુર,
કાયમ રહી જાલાવજે, શુભ મોજ જોમ,
અબડી સાતે જીવજો પારસી કોમ,

Gujarati:

Chhaiye humay Zarthosti^{[L][SEP]}Re
Mazdayasni nek^{[L][SEP]}Kul jehan sathe
dosti^{[L][SEP]}Rakhiye nibhavye
tek^{[L][SEP]}Mootthi bhar aa tolo^{[L][SEP]}Saoo no
sangar^{[L][SEP]}Re bol bala bolo^{[L][SEP]}Oh, saoo
nur ne nar.

**CHORUS^{[L][SEP]}O tokham Kyani! O
jug mashoor!^{[L][SEP]}O saoo sud goon ma
sacchi ne bhurpoor!^{[L][SEP]}Kayem rahi
jalavjo shoobh tooj no jom^{[L][SEP]}Abadi
sathe jivjo Parsi kom!**

Baholi sukhavat hathe^{[L][SEP]}Dechhe jugut
jaher^{[L][SEP]}Bahu chunchulai
saathe^{[L][SEP]}Saoo vatma
meher^{[L][SEP]}Goozari japhao bhari^{[L][SEP]}To
pun na chhodio dharam^{[L][SEP]}Tethi muli
rubiari^{[L][SEP]}Tej khuro chhe bharam!

**CHORUS^{[L][SEP]}O tokham Kyani! O
jug mashoor!^{[L][SEP]}O saoo sud goon ma
sacchi ne bhurpoor!^{[L][SEP]}Kayem rahi
jalavjo shoobh tooj no jom^{[L][SEP]}Abadi
sathe jivjo Parsi kom!**

English Translation:

We are all Zarthostis^{[L][SEP]}Good
Mazdayasnis we^{[L][SEP]}The whole world our
friend is^{[L][SEP]}Let's keep our dignity^{[L][SEP]}Our
Group is a handful and no more^{[L][SEP]}In
learning still we score^{[L][SEP]}Its glory and its
great fame^{[L][SEP]}Let all of us proclaim.

**CHORUS^{[L][SEP]}O Kyani descendants! O
world renowned!^{[L][SEP]}O Truthful ones-
where all virtues abound!^{[L][SEP]}May ye
live for ever and glorious fame
befall^{[L][SEP]}With perfection ever, O ye
Parsis all!**

That you give in widespread
charity^{[L][SEP]}This whole wide world doth
know^{[L][SEP]}With large hearted
generosity^{[L][SEP]}For all, your mercy doth
flow^{[L][SEP]}Through great trials have you
clef^{[L][SEP]}Yet your faith has never
left^{[L][SEP]}Therefore the guidance for you is
His^{[L][SEP]}A Divine Blessing is this.

**CHORUS^{[L][SEP]}O Kyani descendants! O
world renowned!^{[L][SEP]}O Truthful ones-
where all virtues abound!^{[L][SEP]}May ye
live for ever and glorious fame
befall^{[L][SEP]}With perfection ever, O ye
Parsis all!**